

રાજકોટ મહાનગરપાલિકા

ડૉ. આંબેડકર ભવન, ઢેબરભાઇ રોડ, રાજકોટ

-: અખબારી યાદી :-

રાજકોટ મહાનગરપાલિકા, રોટરી મીડટાઉન લાયબ્રેરી અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા તા. ૧૩-૦૧-૨૦૧૯ ના રોજ રોલેક્સ સાયકલોફનનું આયોજન

તા.૧૧-૦૧-૨૦૧૯

રાજકોટ મહાનગરપાલિકા, રોટરી મીડટાઉન લાયબ્રેરી અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા આગામી તા. ૧૩-૦૧-૨૦૧૯ ને રવિવારે સવારે ૪:૩૦ વાગ્યે રોલેક્સ સાયકલોફનનું આયોજન કરવામાં આવેલ છે. શહેરીજનો સાઈકલીંગ જેવા નોનમોટરાઈઝડ ટ્રાન્સપોર્ટેશન વિકલ્પ અપનાવે અને પ્રદુષણ ઓછું કરવામાં સહયોગી બને તેવા આશય સાથે રોલેક્સ સાયકલોફનનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં બહોળી સંખ્યામાં શહેરીજનો ભાગ લે, તેમ મ્યુનિ. કમિશનરશ્રી બંધાનિધિ પાનીએ જણાવ્યું હતું.

મ્યુનિ. કમિશનરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ રોલેક્સ સાયકલોફનમાં કુલ ત્રણ પ્રકારના રૂટ પ્રમાણે કેટેગરી રાખવામાં આવેલ છે. એક ૨૫ કી.મી.ની કેટેગરી, બીજી ૫૦ કી.મી.ની કેટેગરી અને ત્રીજી ૭૫ કી.મી. કેટેગરી રાખવામાં આવી છે. જે વ્યક્તિ સમય મર્યાદામાં રેલી પૂર્ણ કરશે તેવા તમામ લોકોનો ડ્રો કરી પુરસ્કાર આપવામાં આવશે.

૨૫ કી.મી. ના રૂટમાં રેસકોર્ષ બાલભવનથી શરૂ કરીને અંડરબ્રીજ -> કાલાવડ રોડ-> ન્યુ રીંગ રોડ-> ઘંટેશ્વર-> માધાપર ચોકડી-> જામ ટાવર-> આર. વર્લ્ડ-> રેસકોર્ષ થઈને બાલભવનના ગેઈટ પાસે સુધી રહેશે.

૫૦ કી.મી. ના રૂટમાં રેસકોર્ષ બાલભવનથી શરૂ કરીને અંડરબ્રીજ-> કાલાવડ રોડ-> ન્યુ રીંગ રોડ-> ચોકીઘાણી-> એલ્ડોરાડો પાર્ક(ત્યાંથી રીટર્ન)-> માધાપર ચોકડી-> જામ ટાવર-> આર. વર્લ્ડ-> રેસકોર્ષ થઈને બાલભવનના ગેઈટ પાસે સુધી રહેશે.

૭૫ કી.મી. ના રૂટમાં રેસકોર્ષ બાલભવનથી શરૂ કરીને અંડરબ્રીજ-> કાલાવડ રોડ-> ન્યુ રીંગ રોડ-> ચોકીઘાણી-> ભારત હોટલ-> ડેપાલીયા બસ સ્ટોપ(ત્યાંથી રીટર્ન) માધાપર

ચોકડી-> જામ ટાવર-> આર. વર્લ્ડ-> રેસકોર્ષ થઈને બાલભવનના ગેઈટ પાસે સુધી રહેશે.
સાયકલીંગ કરવું વ્યક્તિની તંદુરસ્તી માટે આશીર્વાદરૂપ ગણાય છે. રોલ્ક્સ
સાયકલોફનમાં ભાગ લેનાર તમામ વ્યક્તિને હેલ્મેટ, ટીશર્ટ અપાશે. રૂટ પર પાણી, મેડિકલ
સુવિધા, મ્યુઝીકલ ચીયારીંગ વગેરે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

૨૫ કી.મી.

૨૫ કી.મી. ના રૂટમાં રેસકોર્ષ બાલભવનથી શરૂ કરીને અંડરબ્રીજ -> કાલાવડ રોડ->
ન્યુ રીંગ રોડ-> ઘંટેશ્વર-> માધાપર ચોકડી-> જામ ટાવર-> આર. વર્લ્ડ-> રેસકોર્ષ થઈને
બાલભવનના ગેઈટ પાસે સુધી રહેશે.

૫૦ કી.મી.

૫૦ કી.મી. ના રૂટમાં રેસકોર્ષ બાલભવનથી શરૂ કરીને અંડરબ્રીજ-> કાલાવડ રોડ->
ન્યુ રીંગ રોડ-> ચોકીઘાણી-> એલ્ડોરાડો પાર્ક(ત્યાંથી રીટર્ન)-> માધાપર ચોકડી-> જામ
ટાવર-> આર. વર્લ્ડ-> રેસકોર્ષ થઈને બાલભવનના ગેઈટ પાસે સુધી રહેશે.

૭૫ કી.મી.

૭૫ કી.મી. ના રૂટમાં રેસકોર્ષ બાલભવનથી શરૂ કરીને અંડરબ્રીજ-> કાલાવડ રોડ->
ન્યુ રીંગ રોડ-> ચોકીઘાણી-> ભારત હોટલ-> ડેપાલીયા બસ સ્ટોપ(ત્યાંથી રીટર્ન) માધાપર
ચોકડી-> જામ ટાવર-> આર. વર્લ્ડ-> રેસકોર્ષ થઈને બાલભવનના ગેઈટ પાસે સુધી રહેશે.

(જન સંપર્ક અધિકારી)